

રાજકોટ રૂરલ જિલ્લા :- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- માર્ચ/૨૦૨૧

લુટ

- (૧) ગઈ તા.૨૪/૦૨/૨૦૨૧ ના રોજ રાત્રીના સમયે પડધરી તાલુકાના થોરીયાળી ગામે વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં ફરીયાદી તથા સાહેદને અજાણ્યા ઇસમો દ્વારા લાકડીઓ વતી માર મારી સામાન્ય ઇજાઓ પહોંચાડી રોકડ રકમ તથા સોનાની બુંટી તથા મોબાઇલ ફોનની લુટ કરી લઈ ગયેલ જે અંગે તા.૨૪/૦૨/૨૦૨૧ ના રોજ પડધરી પો.સ્ટે.માં એ પાર્ટ ગુ નં.૧૧૨૧૩૦૪૨૨૧૦૦૯૨/૨૦૨૧ IPC કલમ ૩૯૪,,૧૧૪ જી.પીએક્ટ ૧૩૫, ૩૭(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. આ ગુન્હાનો ભેદ ઉકેલવા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરી, ખાનગી રાહે હકિકત મળેલ કે ફરીયાદીના દિકરાની વાડીમાં ખેતી કામ કરતો (૧) ઇશ્વર સ.ઓ. જુવાનસીંગ દિપસીંગ ડામોર જાતે- આદિવાસી ઉ.વ.૩૦ ધંધો- મજૂરી રહે- હાલ- લજાઇ તા. ટંકારા જી. મોરબી મુળ- પાનમ ગામ, માળીયું ફળીયું તા. ધાનપુર જી. દાહોદ (૨) હરસંગભાઇ ઉર્ફે હરી સ.ઓ. ગોરસીંગ રાવજી ભાંભોર જાતે- આદિવાસી ઉ.વ. ૨૮ ધંધો- ખેતમજૂરી રહે- હાલ- થોરીયાળી ગામ, વીનુભાઇ માહનભાઇ કોટડીયાની વાડીએ તા. પડધરી જી. રાજકોટ મુળ- ભાણપુર ગામ, ભાંભોર ફળીયું તા. ધાનપુર જી. દાહોદ (૩) ગઢુભાઇ જવેરીયાભાઇ પરમાર જાતે- આદિવાસી ઉ.વ. ૩૩ ધંધો- ખેતમજૂરી રહે- હાલ- મોરાણા ગામ, કાંતીભાઇ હરીભાઇ સોનાગરાની વાડીએ તા.જોડીયા જી. જામનગર મુળ- ભાણપુર ગામ, પીપધરા ફળીયું તા. ધાનપુર જી. દાહોદ વાળાઓને બજાજ કંપનીનું ડીસ્કવર મો.સા. કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ. ૧,૫૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ - ૪ કિ.રૂ. ૪૫૦૦/- એમ મળી કુલ રૂ. ૧,૭૯,૫૦૦/- સાથે પકડી પાડી પડધરી પો.સ્ટે.માં દાખલ થયેલ અનડીટેક ગુનો ડીટેક કરેલ તેમજ ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ નીચે જણાવેલ જગ્યાઓએ ઘરફોડ ચોરી કરેલની કબુલાત આપેલ છે.

એન.ડી.પી.એસ. કેસ

- (૧) તા.૧૯/૦૩/૨૦૨૧ ના રોજ ગોંડલસીટી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, સોયબભાઇ અશરફભાઇ તેલી જાતે મેમણ રહે.ગોંડલ નાનીબજાર ગુંદાળા શેરી વોરાની મસ્જીદ પાસે કલાભાના નાકામાં વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ (માદક પદાર્થ) નો જથ્થો રાખી વેચાણ-હેરફેર કરવાના ઇરાદે ગોંડલ રામદ્રાર પાસેથી નીકળનાર હોય જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ વોચમાં રહી હકીકતવાળો ઇસમ સોયબભાઇ અશરફભાઇ તેલી જાતે મેમણ મુસ્લીમ ઉ.વ.૨૬ ધંધો.મજૂરી રહે.ગોંડલ નાનીબજાર ગુંદાળા શેરી વોરાની મસ્જીદ પાસે કલાભાના નાકામાં તા.ગોંડલ જી.રાજકોટવાળા કબજામાંથી ગેર કાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના ઘટકોવાળો માદક પદાર્થનો જથ્થો કુલ વજન ૧૦ કિલો જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો રાખી વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા આરોપીને તા.૧૯/૦૩/૨૦૨૧ ના ક.૧૩/૦૦ વાગ્યે હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ ગોંડલસીટી પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૫૨૧૦૨૪૯/૨૦૨૧ એન.ડી.પી.એસ એક્ટ ક.૮(સી),૨૦બી(૨-બી) મુજબ ગુન્હો રજી. કરાવેલ.
